





Australian Government

કોરોનાવાઇરસ સામે તમારું રક્ષણ કરવા.



શારીરિક અંતર જાળવો



સાબુ અને પાણીથી નિયમિત રીતે હાથ ધૂવો



સપાટીઓ નિયમિત રીતે સાફ કરો



ખાંસી અથવા છીંક તમારી કોણીમાં ખાશો



જો અસ્વસ્થ હોવ, તો ઘરે રહો અને તપાસ કરાવો



COVIDSAFE એપ ડાઉનલોડ કરો

BE COVIDSAFE

કોરોનાવાઇરસ (COVID-19) વિષે વધુ માહિતી માટે health.gov.auની મુલાકાત લેશો

